

**PROPERTY FOR SALE**  
**Residential Tenement No 05,**  
Land adm -352.82, Sq.Mts  
**Building (G.F.+ F.F.) 247.74** Sq. Mts  
Javahar CHS, Opp. APMC  
Market, Gung Bazar Road,  
Visnagar, Dist. Mehsana.  
**For further details call**  
**Shivani Paste +91 9699534999**  
**or**  
**Sahejpal Kapoor +91 9049315353**

**ADMISSION ANNOUNCEMENT**  
Somlali Institute of Management Studies invites applications for Vacant Quota seats for MBA programme-2025 Application forms available and accepted till 07-08-2025 (Friday) till 2.00 PM. Merti list will be displayed on 08-08-2025 followed by Counseling on 11-08-2025. Form Fees Rs. 500/-.  
**SOMLALI INSTITUTE OF MANAGEMENT STUDIES**  
Nr. St. Xavier's College, Navrangpura, Ahmedabad-380009. Gujarat.  
Email : info@somlali.org. Mobile : 7383632936 Tele.: 079-26303301-02-03

**MAHARASHTRA AIRPORT DEVELOPMENT CO. LTD**  
CIN: U45203MH2002SGC136979  
8th floor, Centre-1, World Trade Centre, Cuffs Parade, Mumbai-400005 Tel. No. +91-22-49212121/22  
Consultancy Services for Construction of Link Taxiway (Approx. Length 1400m) from Existing MIHAN Taxiway up to 3 lane road at Sector-10 within processing SEZ of MIHAN notified area Nagpur And (Approx. Length 550m) from Existing MIHAN Taxiway up to Relocated IAF Land for Aircraft Operation in MIHAN Nagpur.  
The detailed advertisement can be seen / downloaded from the website [www.mahatenaders.gov.in](http://www.mahatenaders.gov.in) from 02.08.2025 from 9.00 hours.  
Sd/-  
Vice Chairman and Managing Director

**KIFS KIFS FINANCIAL SERVICES LIMITED**  
Registered Office: 4<sup>th</sup> Floor, KIFS Corporate House, Nr. Land Mark Hotel, Nr. Neptune House, Iskon-Ambli Road, Bodakdev, Ahmedabad – 380054, Gujarat, India. Contact: +91 79 69240000 - 09. CIN: L67990GJ1995PLC025234, E-mail: cs@kifs.co.in, Website: www.kifsfinance.com  
**NOTICE - SPECIAL WINDOW FOR RE-LODGEEMENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES**  
Notice to shareholders is hereby given that pursuant to SEBI circular no. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July 2, 2025, a special window has been opened for re-lodgement of transfer requests of physical shares. This applies to transfers lodged prior to April 1, 2019 and were rejected/returned/not attended to due to deficiency in the documents/process or otherwise.  
The re-lodgement window is open for a period of six months from July 7, 2025 till January 6, 2026 and all such transfers shall be processed and would be issued to the transferee(s) in demat mode only. Due process shall be followed for such transfer-cum-demat requests. Eligible shareholder(s) may submit their transfer request along with the requisite documents to the company or its registrar and share transfer agent (RTA) within the stipulated period. For further assistance or queries regarding the re-lodgement process, kindly contact:  

Company	Registrar and Share Transfer Agent (RTA)
KIFS Financial Services Limited (Khandwala House), Nr. Land Mark Hotel, Nr. Neptune House, Iskon-Ambli Road, Bodakdev, Ahmedabad – 380054, Gujarat, India. Email: cs@kifs.co.in Tel.: +91 79 69240000 - 09	MUFG Intime India Private Limited (Formerly Link Intime Private Limited) 5 <sup>th</sup> Floor, 506 to 508 Amarnath Business Centre - I (ABC - I), Beside Gala Business Centre, Nr. St. Xavier's College Corner, Off C. G. Road, Navrangpura, Ahmedabad - 380009, Gujarat, India. Email: ahmedabad@linkintime.co.in Tel.: +91 79 26465179

  
For KIFS Financial Services Limited, Rajesh P. Khandwala, Managing Director, DIN: 00477673, Ahmedabad, August 2, 2025

**IN THE OFFICE OF THE JOINT CHARTY COMMISSIONER, MEHSANA DIVISION, MEHSANA.**  
1st FLOOR, FAST TRACK COURT BUILDING, RAJ MAHEL COMPOUND, MEHSANA.  
Under section 50A(2) of the Gujarat Public Trust Act 1950. Scheme Amalgamation Application No.21/2023  
(1) Vishvmangalam Kelavani Mandal, Himmatnagar. Trust Reg. No. E/1000/SABARKANTHA  
(2) Shree Sabarkantha District Bavisgam Leuva Patidar Samaj Vikas Mandal, Himmatnagar. Trust Reg. No. E/1524/SABARKANTHA  
Applicants : Shri Dahyabhai Lilabhai Patel And Other 01 v/s.  
Opponents:None  
The above named applicants have applied to the Joint Charity Commissioner, Mehsana Division, Mehsana under Section 50(A)(2) of The Gujarat Public Trust Act, 1950, and have prayed that it is expedient and necessary to amalgamate the above public trusts by framing a comman scheme.  
Notice is hereby given that any person interested in the matter may file his written statement with affidavit on or before date:01/09/2025 at 12.00 a.m. on which the date fixed for hearing before the Joint Charity Commissioner Mehsana Division, Mehsana at the above mentioned address either in person or through post, failing which the matter shall be heard and determined ex-parte and the Joint Charity Commissioner will pass such orders as he deems proper on that day.  
Given under my sign and Seal of this office on date-30/07/2025.  
Sd/-  
(J.K.PANDYA)  
Joint Charity Commissioner, Mehsana Division, Mehsana

**TORRENT POWER LIMITED**  
CIN No.: L31200GJ2004PLC044068  
Reg. office: "Samanvay", 600, Tapovan, Ambawadi, Ahmedabad-380015.  
**PUBLIC NOTICE**  
Torrent Power Ltd. having its registered office at "Samanvay", 600, Tapovan, Ambawadi, Ahmedabad-380015 intends to apply/ has applied to the Government of India to confer upon him all the powers under Section 164 of the Electricity Act, 2003 for the placing of electric lines or electrical plant for the transmission of electricity or for the purpose of telephone or telegraphic communications necessary for the proper coordination of works which telegraph authority possess under the Indian Telegraph Act, 1885 with respect to the placing of telegraph lines and posts for the purpose of a telegraph established or maintained, by the Government or to be so established or maintained and will undertake the survey, construction, installation, inspection, erection and other works to be followed by commissioning, operation, maintenance and other works for the following transmission schemes.  
**Name of the Transmission Scheme:** Providing connectivity to M/s Torrent Power limited for 160MW GNA as Distribution Licensee, Surat near Navsari, Gujarat, TPL (Bhatar) – Navsari (New) (GIS) 220kV D/C line (on Multi Circuit Towers) and associated bays at Navsari (New) end.  
**Works covered under the scheme:** Construction of approximate 17 KM D/C Transmission line (on Multi Circuit Towers) and associated bays at Navsari (New) end  
The transmission line covered under the scheme will pass through, over, around, and between the following villages, towns, and cities.  

Name of villages	Taluka	District
Dipla, Ubhrat, Danti, Bhatha, Magob, Karankhat	Jalalpore	Navsari
Umbur, Gabheni, Talangpore, Kansad	Udhna	Surat

  
Copy of the route alignment is available in the office of the undersigned. Notice is hereby given to the general public to make observation/ representation on the proposed transmission system within two months from the date of publication of this notice to the office of the undersigned in writing.  
**For further particulars and clarifications please contact:**  
**Name:** Mr. Rajendra Dinker  
**Designation:** General Manager  
**Office Address:** Torrent Power Limited, Station Road, Surat-395003  
**Email Address:** rajeshmoliya@torrentpower.com  
**Phone No:** 0261-2400240 / 98240 9930  
**Date:** 01/08/2025  
**Place:** Surat

**AXIS BANK**  
AXIS BANK LIMITED  
CIN: L65110GJ1993PLC020769  
Registered Office: "Trishul" 3<sup>rd</sup> Floor, Opp. Samarsheshwar Temple, Law Garden, Ellisbridge, Ahmedabad-380 006, Gujarat  
Tel No.: +91 79-6630 6161  
Email: shareholders@axisbank.com; Website: www.axisbank.com  
**Special Window for Re-lodgement of Transfer Requests of Physical Shares**  
Pursuant to the SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July 2, 2025, shareholders of the Bank are hereby informed that a Special Window has been opened for a period of six months from July 7, 2025 to January 6, 2026 for re-lodgement of transfer deeds, which were lodged prior to April 1, 2019 and rejected/returned/not attended to due to deficiency in the documents/process or otherwise.  
Eligible shareholders may submit their transfer deeds along with requisite documents to the Bank's Registrar & Share Transfer Agent at KFin Technologies Limited ("KFINT") Unit: Axis Bank Limited, Selenium Building, Tower – B, Plot nos. 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad – 500 032, Telangana, Email: einward.ris@kfintech.com. During this period, the securities that are re-lodged for transfer shall be issued only in dematerialized mode. The details regarding the opening of this special window are also disseminated on the Bank's website at www.axisbank.com.  
**For Axis Bank Limited Sd/- Sandeep Poddar Company Secretary ACS 13819**  
**Place: Mumbai**  
**Date: August 1, 2025**

**IIIT Bhubaneswar**  
Imagine. Innovate. Inspire.  
(A University established by the Government of Odisha)  
**ADVERTISEMENT**  
➤ **M.Tech. (Computer Science and Engineering)**  
➤ **M.Tech. (Signal Processing and VLSI Technology)**  
IIIT Bhubaneswar is a next generation Technology Institute engaged in Under Graduate & Post Graduate education and research. Applications are invited for M.Tech. (CSE) and M.Tech. (Signal Processing and VLSI Technology) Programme.  
For further details visit: <https://www.iiit-bh.ac.in> Sd/-  
**REGISTRAR**

Nashik Shikshan Prasarak Mandal, Nashik  
**Late Bindu Ramrao Deshmukh Arts, Commerce & Science Mahila Mahavidyalaya, Nashik Road (0253-2465967)**  
**WANTED**  
Applications are invited from eligible candidates for the following post.  

Sr.No	Designation	Total Post	Category
1	Principal	01	Open to All

  
**Condition:**  
1) Educational Qualifications & other essential requirements, Pay Scale and Service conditions are as prescribed by the UGC, New Delhi. Government of Maharashtra and Savitribai Phule Pune University, Pune and L.B.R.D. Arts Commerce and Science Mahila Mahavidyalaya Nashik road, Nashik.  
2) Associate Professor/Professor with the total experience of 15 years in teaching/research/ administration in universities, colleges and other institutions of Higher Education.  
3) candidate should submit their API Score record as per UGC norms.  
4) This recruitment procedure is subject to decision by Hon. Bombay High Court, Aurangabad Bench on Writ Petition No.12051/2015 and 15737/2019 filed in Aurangabad bench Mumbai High court & supreme court respectively.  
5) Appointment for the said post will be for tenure of five years from the date of appointment or up to the attainment of the age of superannuation of the candidate, whichever is earlier.  
6) Those who are already in service should apply through proper channel.  
7) All attested Xerox Copies of certificates, other relevant documents related to API score should be attached to the application form.  
8) No TA/DA will paid.  
9) Incomplete application will not be entertained.  
10) Eligible candidates should submit their application form with all the necessary documents within Thirty (30) days from the date of Publication of this advertisement to the following address personally or by registered post.  
11) Kindly send a demand draft of Rs. 200/- for Candidates who belong to Reserve category & Rs. 400/- for candidates of Open Category alongwith application form in favour of "The Secretary, Nashik Shikshan Prasarak Mandal, Nashik." Payable at Nashik.  
12) Parallel reservation for women and differently disable (divyang) shall be applicable as per norms of Government of Maharashtra.  
**Note** : Those who have applied with reference to advertise published on date 08/08/2024 need not to apply again as their applications have been considered.  
Address -  
**The Secretary,** Nashik Shikshan Prasarak Mandal, Nashik. c/o. J.S. Rungta Highschool, Ashok Stambh, Gharpure Ghat, Nashik. Pin.422002.  
**SECRETARY**  
Place : Nashik Nashik Shikshan Prasarak Mandal, Nashik Date 02.08.2025 Website : nspmandal.org


**અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન**  
**મહાનગર સેવા સદન, એસ્ટેટ/નગર વિકાસ ખાતુ, (દક્ષિણગોળ)**  
ડો.શ્યામપ્રસાદ મુખર્જી ભવન, ફાયર સ્ટેશન સામે, કૃષ્ણબાગ ચાર રસ્તા, મહિનગર, અમદાવાદ. ફોન : ૨૫૪૬૨૫૫/એક્ષ. ૩૧૮ Email : dttdosr2@ahmedabadcity.gov.in  
**જાહેર નોટીસ**  
આથી આ જાહેર નોટીસ આપી લાગતા વળગતા સર્વે ને જણાવવામાં આવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર નીચે દર્શાવેલ જુદા જુદા આવાસો આવેલ છે. જે આવસો બચનકર્તા અને જર્જરીત હાલતમાં જણાતા એસ્ટેટ અને નગર વિકાસ ખાતુ, દક્ષિણ ગોળ દ્વારા અગાઉ ધી.જી.પી.એમ. સી. એક્ટની કલમ ૨૬૮ મુજબની આવાસો ખાલી કરવા અંગે વ્યક્તિગત અને જાહેર ધોરણે નોટીસો આપવામાં આવેલ છે, પરંતુ સદર નોટીસ અનુસાર લાગતા વળગતાં સંલગ્ન કબજેદારોએ અમલ કરેલ નથી. સદર આવાસો અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસીંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરાવવામાં આવેલ જાહેર આવાસોના સ્ટ્રક્ચર ઓડીટનાં ઇન્ટરમીડીયટ રીપોર્ટ અનુસાર નીચે દર્શાવેલ આવાસોના બાંધકામ સમબ "It is Strongly advised that the building be evacuated and demolished." મુજબનો રીપોર્ટ આવેલ છે.  

	વોર્ડ	સરનામું	ટી.પી.	એફ.પી.
૧	દાણીલીમડા	પરીક્ષીતલાલ નગર ક્વાટર્સ, ભુલાભાઈ પોલીસ ચોકી પાસે, દાણીલીમડા	૩૭ (દાણીલીમડા) સેક્ટર-૨	૨૩+૨૪
૨	દાણીલીમડા	બહેરામપુરા મ્યુ. હેલ્થ સ્ટાફ ક્વાટર્સ, ઉતવાળી ચાલી પાસે, દાણીલીમડા	૧ (જમાલપુર)	(૫૫+૫૮) પૈકી
૩	બહેરામપુરા	વસંત રજબ ક્વાટર્સ, મેલડીમાતા મંદીર રોડ, બહેરામપુરા	૧ (જમાલપુર)	૮૮
૪	બહેરામપુરા	રૂનેજ પમ્પીંગ સ્ટેશન ક્વાટર્સ, ચેપીરોંગ હોસ્પિટલ રોડ, સબર્બન પમ્પીંગ સ્ટેશન, બહેરામપુરા	૧૩ (બહેરામપુરા)	૮૯
૫	બહેરામપુરા	ગંજ સહીદ મ્યુનિ.ક્વાટર્સ	૩૭ (દાણીલીમડા) સેક્ટર-૧	૮૯
૬	બહેરામપુરા	લાલ બહાદુર શાસ્ત્રીનગર ક્વાટર્સ	૧ (જમાલપુર)	૮૬
૭	મણિનગર	ઉત્તમનગર મ્યુ. ક્વાટર્સ, ઉત્તમનગર બગીચા પાસે, મણિનગર	૨૪ (મણિપુર એક્ષ.)	૭૦
૮	મણિનગર	ભેરવનાથ હેલ્થ ક્વાટર્સ, ભેરવનાથ, મણિનગર	૪ (મણિપુર)	૨૮/૨
૯	મણિનગર	મીરા સ્લમ ક્વાટર્સ, મીરા સિનેમા પાસે, ભેરવનાથ, મણિનગર	૦૪ (મણિપુર)	૨૮૨/પૈકી
૧૦	ખોખરા	સિલ્વર ક્વાટર્સ, રાજપુર ગોમતીપુર	૧૬ (શહેર કોટડા)	૨૮૮
૧૧	ઈન્દ્રપુરી	રઘુવીર એપાર્ટમેન્ટ, (ગરીબ આવાસ યોજના) પંચદેવ મંદીર પાસે, ઓઢવ, અમદાવાદ	૪૨ (ઓઢવ-૨)	૩૭

  
આથી વપરાશકર્તાઓના જાન માલની સલામતી માટે સદરહું આવસો તાત્કાલીક ધોરણે ખાલી કરવા/ કરાવવાના થાય છે, આથી સદરહું આવસોના વપરાશકર્તાઓને ખાસ જણાવવામાં આવે છે કે જાન-માલનું નુકશાન ન થાય તે માટે દિન-ઉત્તરમાં તમામ કબજેદારોએ તેમના માલ સામાન સાથે સદર આવસો એકદમ ખાલી કરી ઉપયોગ બંધ કરવો અને આ આવસોમાં કોઈ પણ પ્રવેશ કરવો નહિ તથા તમારા કબજાવાળી જગ્યામાં કોઈ પ્રવેશે ત્યાં તો તેની તકેદારી રાખવી અન્યથા આ આવસોમાં કોઈપણ જાતનું જાન માલનું નુકશાન થશે તેની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે. જેની ગંભીર નોંધ લેશો.  
**૩. મ્યુનિસિપલ કમિશનર (દક્ષિણ ગોળ)**

**CHARTERED LOGISTICS LIMITED**  
B-501, STELLAR, OPP. ARISTA, SINDHU BHAVAN ROAD, AHMEDABAD-380059  
Website : www.chartered.co.in, Email : cs@chartered.co.in, Tel.: 079 26891752, CIN No.: L74140GJ1995PLC026351  
**STATEMENT OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & YEAR ENDED 30<sup>th</sup> JUNE, 2025**  
(Amount in Lakhs Except EPS)  

Sr. No.	Particulars	Standalone				Consolidated			
		Quarter ended		Year Ended		Quarter ended		Year Ended	
		30.06.2025	31.03.2025	30.06.2024	31.03.2025	30.06.2025	31.03.2025	30.06.2024	31.03.2025
		Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited
1.	Total income from Operations(net)	2110.18	1857.52	2250.73	7868.33	2110.18	1857.52	2250.73	7868.33
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	226.46	(100.66)	151.88	178.54	226.46	(116.48)	151.88	162.72
3.	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	226.46	(100.66)	151.88	178.54	226.46	(116.48)	151.88	162.72
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	202.46	(96.52)	129.88	138.68	202.46	(111.57)	129.88	123.63
5.	Total Comprehensive income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	-	-	-	-	-	-	-	-
6.	Paid up Equity Share Capital	1202.40	1202.40	993.40	1,202.40	1,202.40	1,202.40	993.40	1,202.40
7.	Other Equity	0	0	0	0	0	0	0	0
8.	Earnings Per Share (of Rs.1/- each) (not annualised)								
a. Basic:		0.17	(0.08)	0.13	0.12	0.15	(0.09)	0.13	0.10
b. Diluted:		0.17	(0.08)	0.13	0.12	0.15	(0.09)	0.13	0.10

  
**Note : 1.** The above Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 31<sup>st</sup> July 2025. The statutory auditors have carried out a limited review of the results for the quarter ended June 30, 2025 and have expressed an unqualified audit opinion. 2. The figures for the previous period/year have been regrouped / reclassified, wherever necessary. 3. This Statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind As), prescribed under section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable. 4. The Disclosure is as per Regulation 33 of SEBI (Listing Obligations & Disclosures Requirements) Regulations, 2015. 5. The Company is operating in single segment, so above results are for single segment only. 6. The Company has acquired stake of 99.99% in the subsidiary company namely "Chartered Comcare IFSC Limited", therefore the consolidation has done only for the quarter and year ended on 31<sup>st</sup> March, 2025 & quarter ended 30<sup>th</sup> June, 2025.  
  
**Place: Ahmedabad**  
**Date: 31.07.2025**  
**For and on behalf of the Board of Directors of Chartered Logistics Limited Sd/- Lalit Kumar Gandhi (Managing Director) DIN: 00618427**

**SRG HOUSING FINANCE LIMITED**  
CIN: L65922RJ1999PLC015440  
Reg. Off: 321, S M Lodha Complex, Near Shastri Circle, Udaipur-313001 (Rajasthan)  
Phone: 0294-2412609 E-mail: info@srghousing.com Website: www.srghousing.com  
**SYMBOLIC POSSESSION NOTICE RULE 8(1) (For Immovable Property)**  
Whereas, the undersigned being the authorized officer of SRG Housing Finance Limited, 321, SM Lodha Complex, Near Shastri Circle, Udaipur – 313001 (Rajasthan), under the Securitization And Reconstruction of Financial Assets and Enforcement Of Security Interest Act, 2002 and in exercise of power conferred under section 13(12) read with rule 3 of Security Interest (Enforcement) Rules, 2002, issued demand notices on the dates mentioned against each account calling upon the respective borrowers/co-borrowers/mortgagees/guarantors to repay the amount within 60 days from the date of receipt of the said notices. The borrowers/co-borrowers/mortgagees/guarantors having failed to repay the amount, notice is hereby issued to the borrowers/co-borrowers/mortgagees/guarantors and the public in general, that the undersigned has taken **Symbolic Possession** of the properties described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act, read with rule 9 of the said rules, on the dates mentioned against each account. The borrowers/co-borrowers/mortgagees/guarantors in particular and public in general are hereby cautioned **NOT to deal with the properties** and any dealing with the properties will be subject to the charge of SRG Housing Finance Limited, 321, SM Lodha Complex, Near Shastri Circle, Udaipur – 313001 (Rajasthan), for the amounts mentioned below plus future interest and cost/charges thereon until the realization. The Borrowers/Co-borrowers/Mortgagees/Guarantors attention are invited to the provisions of sub-section (8) of section 13 of the said Act, in respect of time available to redeem the available secured assets.  

S. No.	Loan Account Number (Lan/ No.)	1) Date Of Demand Notice 2) Date Of Symbolic Possession 3) Claim Amount As Per Demand Notice	Description Of Immovable Property (Together With Buildings And Structures Constructed, To Be Constructed Thereon Along With Fixtures And Fittings Attached To The Earth And Anything Attached To The Earth.)
1.	HLR00000000016755 Mrs. Lilaben Khant W/o Late Mr. Jitunish (legal heir Being Widow Of Late Mr. Jitunish Bharatsinh Khant) (Borrower-1) Mr. Bharatbhai Zala S/o Mr. Babaji (legal heir Being Father Of Late Mr. Jitunish Bharatsinh Khant) (Borrower-2) Mrs. Lilaben Khant W/o Mr. Jitunish (Co-Borrower-1) Mr. Bharatbhai Zala S/o Mr. Babaji (Co-Borrower-2) Mr. Vishal Solanki S/o Mr. Kalaji (Guarantor)	1. Date Of Demand Notice- March 13, 2025 2. Date Of Symbolic Possession – July 29, 2025 3. Claim Amount As Per Demand Notice- ₹ 2,68, 110/- In Words Rupees Two Lakh Sixty-eight Thousand One Hundred And Ten Only As On March 12, 2025 Plus Future Interest, Incidental Expenses, Cost, Charges, Etc. W.e.f. March 13, 2025.	All That Piece And Parcel Of Land Owned By:- In The Name Mr. Bharatbhai Zala S/o Mr. Babaji Zala Having Gram Panchayati Property No.- 102/1, Gram-Demaliya, Tehsil- Dehgam, District – Gandhinagar (Gujarat) Having Land Area Of 600.00 Sq.ft. Surrounded By:- East – Plot Of Bhalaji, West – Road, North – Farm Of Dipaji, South – House Of Babaji
2.	HLR00000000014691 Mr. Surendrasinh Rathod S/o Mr. Champaksinh (Borrower) Mrs. Kalpanaben Rathod W/o Mr. Surendrasinh (Co-Borrower) Mr. Dashrathi Thakor S/o Mr. Motiji Thakor (Guarantor)	1. Date Of Demand Notice- March 14, 2025 2. Date Of Symbolic Possession – July 29, 2025 3. Claim Amount As Per Demand Notice- ₹ 3,97,680/- In Words Rupees Three Lakh Ninety-seven Thousand Six Hundred And Eighty Only As On March 07, 2025 Plus Future Interest, Incidental Expenses, Cost, Charges, Etc. W.e.f. March 08, 2025.	All That Piece And Parcel Of Land Owned By:- In The Name Mr. Surendrasinh Rathod S/o Mr. Champaksinh Having Property No.- 909, Pathu Ji Ni Muvadi, Gram-Devkaran Na Muvada, Tehsil – Dehgam, District–Gandhinagar (Gujarat) Having Land Area Of 960.00 Sq.ft. Surrounded By:- East – Road, West – House Of Shankuben, North – House Of Pravinbhai South – Road
3.	HLR00000000012971 Mr. Naginbhai Jalambhai Zala S/o Mr. Jalambhai (Borrower) Mrs. Hansaben Zala S/o Mr. Naginbhai (Co-Borrower) Mr. Ramsinh Rathod S/o Mr. Mangalsinh (Guarantor)	1. Date Of Demand Notice- January 16, 2025 2. Date Of Symbolic Possession – July 30, 2025 3. Claim Amount As Per Demand Notice- ₹ 3,70,770/- In Words Rupees Three Lakh Seventy Thousand Seven Hundred And Seventy Only As On January 07, 2025 Plus Future Interest, Incidental Expenses, Cost, Charges, Etc. W.e.f. January 08, 2025.	All That Piece And Parcel Of Land Owned By:- In The Name Mr. Naginbhai Jalambhai Zala S/o Mr. Jalambhai Zala Having Mikat No.-508, Bhatiji Vadu Faliyu, Nr. Bhatiji Tempel, Gram-Mandawna Muvada, Tehsil-Kapadvani, District-Kheda (Gujarat) Having Land Area Of 800.00 Sq.ft. Surrounded By:- East – Road, West – Land Of Laxmanbhai Babubhai, North – Land Of Laxmanbhai Babubhai, South – House Of Rajeshbhai Kantibhai
4.	HLR00000000019221 Mr. Ranjithbhai Parmar S/o Mr. Charababhai (Borrower) Mrs. Parmar Sumitaben W/o Mr. Ranjithkumar (Co-Borrower) Mr. Parmar Ramanbhai S/o Mr. Shakrabhai (Guarantor)	1. Date Of Demand Notice- February 21, 2025 2. Date Of Symbolic Possession – July 30, 2025 3. Claim Amount As Per Demand Notice- ₹ 3,20,590/- In Words Rupees Three Lakh Twenty Thousand Five Hundred And Ninety Only As On February 08, 2025 Plus Future Interest, Incidental Expenses, Cost, Charges, Etc. W.e.f. February 09, 2025.	All That Piece And Parcel Of Land Owned By:- In The Name Mr. Ranjithbhai Chhababhai Parmar S/o Mr. Chhababhai Having GP Property No. 862, Old Property/ House No. 418, Thakor Vas, Gram- Dantali, Tehsil-Kapadvani, District-Kheda (Gujarat) Having Land Area Of 720.00 Sq.ft. Surrounded By:- East – Open Space, West – Sankebhai Ranjithbhai, North – Road, South – Open Space
5.	HLR00000000012733 Mr. Ramabhai Rameshbhai Solanki S/o Mr. Rameshbhai Solanki (Borrower) Mrs. Nitaben Ramabhai Solanki W/o Mr. Ramabhai Solanki (Co-Borrower) Mr. Natvarbhai Saburbhai Parmar S/o Mr. Saburbhai (Guarantor)	1. Date Of Demand Notice- April 10, 2025 2. Date Of Symbolic Possession – July 30, 2025 3. Claim Amount As Per Demand Notice- ₹ 2,68,770/- In Words Rupees Two Lakh Sixty-eight Thousand Seven Hundred And Seventy Only As On April 09, 2025 Plus Future Interest, Incidental Expenses, Cost, Charges, Etc. W.e.f. April 10, 2025	All That Piece And Parcel Of Land Owned By:- In The Name Mr. Ramabhai Rameshbhai Solanki S/o Mr. Rameshbhai Solanki Having Gram Panchayati Property No.- 372/1, Gram-Dudhthal, Tehsil-Kapadvani, District- Kheda (Gujarat) Having Land Area Of 675.00 Sq.ft. Surrounded By:- East-House Of Vijaybhai Bhikhabhai, West-House Of Govindbhai Swarupbhai, North-House Of Vinodbhai Lallubhai, South-House Of Madhubhai Dahyabhai

  
**PLACE:- GUJARAT**  
**DATE:- 02-08-2025**  
**Sd/-**  
**Authorized Officer, SRG Housing Finance Limited**

**SHREE GANESH REMEDIES LIMITED**  
CIN No. : L24230GJ1995PLC025661  
**Registered Office :** Plot No. 6002, 6003, 6011 & 6012, G.I.D.C., Ankleshwar IE, Bharuch, Ankleshwar, Gujarat, India, 393001  
**Phone : 7574976076 • Web.: www.ganeshremedies.com**  
**Email: investors@ganeshremedies.com**  
**EXTRACT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025**  
(Amount in Lakhs, except as stated otherwise)  

Sr. No.	Particulars	Quarter Ended June 30, 2025	Quarter Ended March 31, 2025	Quarter Ended June 30, 2024	Year Ended March 31, 2025
		Unaudited	Audited	Unaudited	Audited
		1. Total Income from Operations	2466.79	2443.19	2477.99
2. Net Profit for the period (before Tax, Exceptional and / or extraordinary items)	459.80	877.42	633.18	3126.76	
3. Net Profit for the period before tax (after Exceptional and / or extraordinary items)	344.62	877.42	465.93	3126.76	
4. Net Profit for the period after tax (after Exceptional and / or extraordinary items)	344.51	659.00	464.88	2306.84	
5. Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	344.16	660.13	465.62	2305.70	
6. Equity Share Capital (Face value Rs. 10/- each)	1283.76	1283.76	1283.76	1283.76	
7. Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	13,231.76	
8. Earnings Per Share for Continuing operation (of Rs. 10/- each) (Not Annualised)					
1. Basic	2.68	5.13	3.62	17.96	
2. Diluted	2.68	5.13	3.62	17.96	

  
**EXTRACT OF STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025**  

Sr. No.	Particulars	Quarter Ended June 30, 2025	Quarter Ended March 31, 2025	Quarter Ended June 30, 2024	Year Ended March 31, 2025
		Unaudited	Audited	Unaudited	Audited
		1. Total Income from Operations	2466.79	2443.19	2477.99
2. Profit before tax	459.80	878.12	633.49	3129.73	
3. Profit after tax (after Other Comprehensive Income)	344.96	660.82	465.19	2308.50	
4. EBITDA	795.83	1216.42	866.87		



[illegible]

**GO COLORS!**  
GO FASHION (INDIA) LIMITED

**GO FASHION (INDIA) LIMITED**  
CIN: L17291TN2010PLC077303  
Registered office :No 43/20, Nungambakkam High Road ,  
Chennai, Tamil Nadu 600034. Phone :044-4211 1777  
Website : [www.gocolors.com](http://www.gocolors.com) | E-Mail : [companysecretary@gocolors.com](mailto:companysecretary@gocolors.com)

**UNAUDITED FINANCIAL RESULTS  
FOR THE QUARTER ENDED JUNE 30, 2025**

Based on the recommendations of the audit committee, the Board of Directors of GO FASHION (INDIA) LIMITED ("the company") at its meeting held on August 01, 2025 has approved the unaudited financial results for the quarter ended June 30, 2025 which have been subject to a limited review by Price Waterhouse Chartered Accountants LLP, Statutory Auditors of the company, in terms of Regulation 33 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015


The aforesaid results are also being disseminated on Company's website at <https://www.gocolors.com/investor-relations>. and can also be accessed by Scanning a Quick Response code given here:



Scan the QR Code to view the financial results on the website of the company

**For Go Fashion (India) Limited**  
**Gautam Sarangi**  
Executive Director & CEO  
DIN : 03209296

Place : Chennai  
Date : August 01, 2025

STEELCAST LIMITED					
CIN: L27310GJ1972PLC002033		Regd. Office: Ruvapari Road, Bhavnagar - 364 005.			
Extract of Standalone Unaudited Financial Results of the Company for the Quarter ended June 30, 2025		(Rs. in Lakhs except EPS)			
Sr. No.	Particulars	Quarter Ended			Year Ended
		30.06.2025 (Unaudited)	31.03.2025 (Audited)	30.06.2024 (Unaudited)	31.03.2025 (Audited)
1	Income from operations	10,668.55	12,009.39	7,744.66	37,338.75
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	2,666.12	3,608.32	1,753.07	9,732.55
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	2,666.12	3,608.32	1,753.07	9,732.55
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	1,988.26	2,676.65	1,292.98	7,219.79
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,970.29	2,640.08	1,278.78	7,174.16
6	Equity Share Capital	1,012.00	1,012.00	1,012.00	1,012.00
7	Other Equity excluding revaluation reserves				31,575.40
8	Earnings Per Share (EPS) of Rs. 5.00 each (Not annualized)				
	a) Basic (Rs.)	9.82	13.22	6.39	35.67
	b) Diluted (Rs.)	9.82	13.22	6.39	35.67

**Notes:**

- The above is an extract of the detailed format of standalone unaudited financial results for the quarter ended June 30, 2025 which has been reviewed by the Audit Committee and approved by the Board of Directors. The detailed results are available on the website of the NSE and BSE at [www.nseindia.com](http://www.nseindia.com) and [www.bseindia.com](http://www.bseindia.com) respectively and also on the Company's website at the link given below.
- The Board of Directors of the company have declared first interim dividend at the rate of Rs. 1.80 per share (i.e. 36% of face value per share of Rs. 5.00) of the Company for the financial year 2025-26.
- The full results along with the Limited Review Report have been posted on the Company's website at [https://steelcast.net/pdf/quarterly\\_result/Q1FY26Outcome.pdf](https://steelcast.net/pdf/quarterly_result/Q1FY26Outcome.pdf) and can also be accessed by scanning the Quick Response (QR) code given below:

For and On Behalf of Board of Directors of  
STEELCAST LIMITED  
Sd/-  
(Chetan M Tamboli)  
CHAIRMAN AND MANAGING DIRECTOR  
DIN: 00028421

Place: Bhavnagar  
Date: July 31, 2025


**KIFS FINANCIAL SERVICES LIMITED**

**Registered Office:** 4<sup>th</sup> Floor, KIFS Corporate House, Nr. Land Mark Hotel, Nr. Neptune House, Iskon-Ambli Road, Bodakdev, Ahmedabad - 380054, Gujarat, India.  
**Contact:** +91 79 69240000 - 09, **CIN:** (K67994000 - 09, **CIN:** I6995P1995P10C25234,  
**E-mail:** cs@kifs.co.in, **Website:** www.kifsfinance.com

**NOTICE - SPECIAL WINDOW FOR  
 RE-LODGE/MENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES**

Notice to shareholders is hereby given that pursuant to SEBI circular no. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July 2, 2025, a special window has been opened for re-lodgement of transfer requests of physical shares. This applies to transfer deeds lodged prior to April 1, 2019 and were rejected/returned/not attended to due to deficiency in the documents/process/or otherwise.

The re-lodgement window is open for a period of six months from July 7, 2025 till January 6, 2026 and all such transfers shall be processed and would be issued to the transferee(s) in demat mode only. Due process shall be followed for such transfer-cum-demat entries. Eligible shareholder(s) may submit their transfer request along with the requisite documents to the company or its registrar and share transfer agent (RTA) within the stipulated period. For further assistance or queries regarding the re-lodgement process, kindly contact:

Company	Registrar and Share Transfer Agent (RTA)
<b>KIFS Financial Services Limited</b> 4 <sup>th</sup> Floor, KIFS Corporate House (K67994000 House), Nr. Land Mark Hotel, Nr. Neptune House, Iskon- Ambli Road, Bodakdev, Ahmedabad - 380054, Gujarat, India. Email: cs@kifs.co.in Tel.: +91 79 69240000 - 09	<b>MUGF Intime India Private Limited</b> (Formerly Link Intime Private Limited) 5 <sup>th</sup> Floor, 506 to 508 Amarnath Business Centre - I (ABC - I), Beside Ganga Business Centre, Nr. St. Xavier's College Corner, Off C. G. Road, Navarangpura, Ahmedabad - 380009, Gujarat, India. Email: ahmedabad@linkintime.co.in Tel.: +91 79 26465179

**For KIFS Financial Services Limited, Rajesh P. Khandwala,**  
 Managing Director, DIN: 00477673, Ahmedabad, August 2, 2025

ECOBIX INDUSTRIALS ASSET I PRIVATE LIMITED				
Corporate Identity Number: U52109MH2024PTC429900				
Registered Office: HD-723, WeWork Vaswani Chambers, 2nd Floor, 264-265, Dr Annie Besant Rd, Municipal Colony, Worli Shivaji Nagar, Worli, Mumbai- 400 030				
Tel.: +91 9167736989   E-mail: Compliance@ecobix.com   Website: www.ecobix.com				
STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2025				
(Rs. In Lakhs)				
Sr. No	Particulars	Quarter Ended		Year Ended
		30.06.2025 (Unaudited)	31.03.2025 (Unaudited)	31.03.2025 (Audited)
1	Total Income from operations	23.43	23.43	32.02
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/orExtraordinary items)	(726.11)	(982.68)	(1,158.07)
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(726.11)	(982.68)	(1,158.07)
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(540.85)	(748.86)	(899.97)
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) And Other Comprehensive Income (after tax)	(540.85)	(748.86)	(899.97)
6	Paid up Equity Share Capital	10.00	10.00	10.00
7	Reserves (excluding Revaluation Reserve)	34,331.43	34,872.28	34,872.28
8	Securities Premium Account	-	-	-
9	Net worth	34,526.69	34,904.86	35,140.38
10	Paid up Debt Capital/ Outstanding Debt	23,832.33	23,440.47	23,440.47
11	Outstanding Redeemable Preference Shares	-	-	-
12	Debt Equity Ratio	0.69	0.67	0.67
13	Earnings Per Share (of Rs 10/- each)-			
1	Basic	(2,399.51)	(2,132.58)	(2,562.92)
2	Diluted:	(2,399.51)	(2,132.58)	(2,562.92)
14	Capital Redemption Reserve	NA	NA	NA
15	Debtenture Redemption Reserve	NA	NA	NA
16	Debt Service Coverage Ratio	(0.10)	(1.06)	(0.92)
17	Interest Service Coverage Ratio	(0.10)	(1.06)	(0.92)
<b>1) Net worth = Share capital + Reserves &amp; Surplus – Deferred Tax Assets</b> <b>2) Paid up Debt Capital/ Outstanding Debt = Total Debt</b> <b>3) Debt Equity Ratio = Total Debt/ Net worth</b> <b>4) DSCR = (Profit before interest and tax/ Interest expense)</b> <b>5) ISCR = Profit before interest and tax/ Interest expense</b>				
Notes:				
1. The above is an extract of the detailed format of quarter and period ended financial results filed with the Stock Exchanges in accordance with Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the 'Listing Regulations, 2015'), as amended. The full format of quarter and period ended financial results are available on the websites of the Stock exchange and the Company's website ( <a href="https://www.ecobix.com/">https://www.ecobix.com/</a> ).				
2. For the other line items referred in regulation 52 (4) of the LODR Regulations, pertinent disclosures have been made to the Stock Exchange and the Company's website ( <a href="https://www.ecobix.com/">https://www.ecobix.com/</a> ).				
3. The above financial results of the Company are reviewed and have been approved by the Board of Directors of the Company at their respective meeting held on August 01, 2025. The results have been subject to limited review by the Statutory Auditors of the Company, who have issued an unmodified report on the same.				
For Ecobix Industrials Asset I Private Limited				
Ashish Shah Director				
DIN : 06898999				
Date : 1 August 2025 Place : Mumbai				

<b>ECOBX INDUSTRIALS ASSET II PRIVATE LIMITED</b>				
<b>Corporate Identity Number: U52109MH2024PTC429953</b>				
<b>Registered Office:</b> HD-719, WeWork Vaswani Chambers, 2nd Floor, 264-265, Dr Annie Besant Rd, Municipal Colony, Worli Shivaji Nagar, Worli, Mumbai- 400 030 <b>Tel.:</b> + 91 9167736898   <b>E-mail:</b> Compliance@ecoboxi.com   <b>Website:</b> www.ecoboxi.com				
<b>STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2025</b>				
(Rs. In Lakhs)				
Sr. No	Particulars	Quarter Ended		Year Ended
		30.06.2025 (Unaudited)	31.03.2025 (Unaudited)	31.03.2025 (Audited)
1	Total Income from operations	14.25	14.25	22.96
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/orExtraordinary items)	(235.07)	(311.17)	(505.46)
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(235.07)	(311.17)	(505.46)
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(174.00)	(233.49)	(389.46)
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(174.00)	(233.49)	(389.46)
6	Paid up Equity Share Capital	10.00	10.00	10.00
7	Reserves (excluding Revaluation Reserve)	9,019.27	9,203.26	9,203.26
8	Securities Premium Account	-	-	-
9	Paid up Debt Capital/ Outstanding Debt	9,090.35	9,329.26	9,329.26
10	Outstanding Redeemable Preference Shares	7,761.03	7,311.58	7,311.58
12	Debt Equity Ratio	0.86	0.82	0.82
13	Earnings Per Share (of Rs.10/- each):			
1	Basic	(259.35)	(553.83)	(923.79)
2	Diluted:	(259.35)	(553.83)	(553.83)
14	Capital Redemption Reserve	NA	NA	NA
15	Debiture Redemption Reserve	NA	NA	NA
16	Debt Service Coverage Ratio	(0.14)	(0.13)	(0.47)
17	Interest Service Coverage Ratio	(0.14)	(0.13)	(0.47)

1 Net worth = Share capital + Reserves & Surplus – Deferred Tax Assets

2 Paid-up Debt Capital/ Outstanding Debt = Total Debt

3 Debt Equity Ratio = Total Debt/ Net worth

4 DSCR = (Profit before interest and tax)/ (Interest expense)

5 ISCR = Profit before interest and tax/ Interest expense

Notes:

- The above is an extract of the detailed format of quarter and period ended financial results filed with the Stock Exchanges in accordance with Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the Listing Regulations, 2015), as amended. The full format of quarter and period ended financial results are available on the websites of the Stock exchange and the Company's website (<https://www.ecoboxi.com/>).
- For the other line items referred in regulation 52 (4) of the LODR Regulations, pertinent disclosures have been made to the Stock Exchange and the Company's website (<https://www.ecoboxi.com/>).
- The above financial results of the Company are reviewed and have been approved by the Board of Directors of the Company at their respective meeting held on 1 August 2025. The results have been subject to limited review by the Statutory Auditor/s of the Company, who have issued an unmodified report on the same.

**For Ecobox Industrials Asset II Private Limited**

**Ashish Shah Director**  
 DIN: 06898999  
 Date: 1 August 2025 Place : Mumbai



**बैंक ऑफ बरોडा**  
**Bank of Baroda**

**મિલકતના કબજાને લગતી સુધના**  
**(સ્થાયર મિલકત નું)**

(As Per appendix IV read with rule 8 (1) of the Security Interest (Enforcement) Rules 2002)

નીચે સહી કરનારાએ સીક્યુરીટાઇઝેશન એન્ડ રીફાઇન્સિંગ ઓફ ઈન્ડિયન સ્ટેટીયલ એસેટ્સ એન્ડ એગ્રીમેન્ટેસ ઓફ સીક્યુરીટી ઇન્ફર્મેટર ઓફ, ૨૦૦૨ હેઠળ તેમજ કલમ ૩૧ (૧૨) ના નિયમ ૩ ની સાથે પાંચતો સીક્યુરીટી ઇન્ફર્મેટર (એગ્રીમેન્ટ) રૂસ ૨૦૦૨ મુજબ અધિકારો હેઠળ એક ઓફ બરોડા ના અધિકૃત અધિકારીની રૂબરૂ એવી જણાવેલાં દેવાદાર સી લેન્ડિંગના હેલ્થકેરિંગના સોનાવાળે ને ડીમાન્ડ નોટીસ તા.૨૫-૦૪-૨૦૨૨ પાઠાવીને નોટીસમાં રાખેલી રકમ રૂ. ૧૨,૯૧,૩૦૮/- (૩). બાર બાલ હોટેલ ડેલ્ટા હજાર સુધે અઢાણ (અઢાણ પુરા) ૨૫/૦૪-૨૦૨૨ મુજબ સાથે વધુ વ્યાજ લાગુ કરાર દેવે તેના પર + ફિક્સત, ચાર્જિસ એને ખર્ચ સુધવાળી તારીખ સુધી, આ સૂચના જારી ક્યાંની તારીખથી ૬૦ દિવસની મુદતમાં પરત સુધવાળી જણાવેલાં દેવા.

બાદી દેવાદાર એવી જણાવેલી રકમોને પરત સુધવાળી ક્યાંના નિજેળ ગણા હોવાથી, આ સાથે બાદી દેવાદાર એને નાગાફિરતે જણાવવામાં આણે છે એવી સહી કરનારે એને આવેલા કોષ્ટકમાં દર્શાવેલી મિલકતનું ઉપર જણાવેલા નિમોના ના કિસ્કારીની ઇન્ફર્મેટર એગ્રીમેન્ટ (એગ્રીમેન્ટ) ને સંબંધિત ૧૩મી પેજ કલમ (૪) ની સાથે વધુકસ એક્ટ વાંચતા પ્રાપ્ત થતી સત્તાઓ અનુસાર કબજે તા. ૨૬ માર્ચ ૨૦૨૫ ના રોજ લીધે છે.


બાદી દેવાદાર/ગેરેટ/એગ્રીમેન્ટ વાળા વ્યક્તિનારે પરી તબેજ કરવામાં આ સાથે સાવધાન ક્યામાં આવે છે કે આ મિલકત સાથે કોઈ સોદો (DEAL) કરવાની બંધી એને રોજ આ મિલકત સાથે કોઈ કરશે તો એક ઓફ બરોડા, અર્ટ-૦૧-૨૦૨૫ રૂ. ૧૫,૫૬,૨૧૩/- (૩). પરત બાલ પાંસે હજાર સો રેર પુરા, ૨૬/૦૪-૨૦૨૫ મુજબ એને વધુ વ્યાજ લાગુ કરાર દેવે તેના પર + ફિક્સત, ચાર્જિસ એને ખર્ચ સુધવાળી તારીખ સુધી.

સરકેરી એક્ટ (એગ્રીમેન્ટ) ની કલમ ૩૧ (૨) ના અનુચે આપેલ સમય મર્યાદાના સંદર્ભમાં ધિરાણ લેનારાઓનો કોઈપણ જાનો કલે કે રૂચુઆત માર્યા સરકેરી નહીં.

**સ્થાયર મિલકત નું પાર્શન**

સ્થાયર મિલકતનો કલેટ નં. ૩૦૨, નીજી નામ, સેપ્તેમ્બ ૬.૫૦ રેસ.મીટર સુપર બિલ્ડ અપ એપીમાં માં સેલ્લ ખર્ચ જે સ્પિલ વહોરા નિવાર ને, ટીકા નં. ૧૧/૫, સીટી સં. નં. ૧૬/૧, હોસેળ ૩૧૧.૮૭૬.૨૨ રેસ.મીટર જે મોજે કાસા, રુપરેસેશન કીટીકીટ અને સમ કીટીકીટ વહોરામાં આવેલ છે. જેની ચલુરનીના : પૂર્વ : મિલકતો ને રકમોને સીટી સં. નં. ૩૦૨ નં. ૨૧ વિગેરે, પશ્ચિમ : રોડ, ઉત્તર : કલેટ નં. ૩૦૧, દક્ષિણ : અડીને મિલકત તારીખ ૧૬-૦૪-૨૦૨૨ મુજબ : કોઈકર

અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા


**પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ**  
 CIN: 14200162008PCLC054868 Website: [www.pspprojects.com](http://www.pspprojects.com)  
 રજુ ઓફિસ: પીએસપી હાઉસ, સેલેસ્ટા રોડેડાઈની સામે,  
 વિકનગર કોલોની ની સામેની ગલી, ઉડ્ડોન-ગાંધીની રોડ, અમદાવાદ-૩૮૦૦૧૮  
 ફોન: +91 79 26936200/ +91 79 26936300 મેઇલ: [grievance@pspprojects.com](mailto:grievance@pspprojects.com)

**શેરધારકોને સૂચના**

**કંપનીના ઈમ્પીડી શેરનું ઈન્વેસ્ટર એચયુકેશન અને પ્રોટેક્શન ફંડ (IEFP) નું ટ્રાન્સફર**

પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ ("કંપની")ના સંબંધેના સૂચના આપવામાં આવે છે કે કંપનીના અધિનિયમ, ૨૦૧૩ ના કલમ ૨૫૨(૬) અને ૨૫૨ ના પ્રાવધાન મુજબ, ઈન્વેસ્ટર એચયુકેશન અને પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (એકાઉન્ટિંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રિફંડ) નિયમો, ૨૦૧૯ ("નિયમો") જે મિનિસ્ટરી ઓફ કોર્પોરેટ અફેયર્સ (MCA) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને સમાજાતરે સુચકામાં આપ્યા છે, કંપનીએ એવા બધા ફંડો કે જેના સંબંધમાં ડિવિડન્ડ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૮ થી સંતત સાત પ્રક્રિયા દાખો ન કરાવેલે આવ્યા સુધવામાં ન આવ્યા હોય તે નિયમોમાં દર્શાવેલ પ્રક્રિયા અનુસાર IEFP ને ટ્રાન્સફર કરવા પડેથી છે.

તે મુજબ, નાણાકીય વર્ષ ૨૦૧૫-૨૬ દરમિયાન જે શેરધારકોના IEFP ઓથોરિટીને ટ્રાન્સફર કરવાના છે તેમની યાદી કંપનીની વેબસાઇટ [www.pspprojects.com](http://www.pspprojects.com) પર અપલોડ કરવામાં આવી છે. વધુમાં, કંપનીએ સંબંધિત શેરધારકો કે જેના શેર IEFPમાં ટ્રાન્સફર કરવાના છે તેમને વ્યક્તિગત રીતે પણ કહી છે.

ર નવેમ્બર, ૨૦૨૫ના રોજ અચવા તે પહેલાં સંબંધિત શેરધારકો પાસેથી માન્ય દાખો પ્રાપ્ત ન થાય, તો કંપની કોર્પોરેશન યુથ સૂચના વિના IEFPને જવાબદાર શેર અને તેના પર ડિવિડન્ડ ફંડ કરવાની પ્રક્રિયા કરશે.

કા કંપનીને નોંધ્યું હતું કે દાખો ન કરાવેલા ડિવિડન્ડના સંદર્ભમાં કંપની/ રિસર્વિસર અને ટ્રાન્સફર એજન્ટ સામે કોઈ કોર્ટ યોજ શકશે નહીં. સંબંધેના વધુમાં નોંધ લેવાની વિનંતી છે કે દાખો ન કરાવેલ ડિવિડન્ડ અને IEFP નાં ટ્રાન્સફર કરાવેલા શેર બંને, જેમાં આવ્યા શેર પર મળતા નામોલ વળે, બે કોર્ટ હોય તો, IEFP નિયમો હેઠળ નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને ઓથોરિટી દ્વારા પાછા દાખો કરી શકાય છે.


ઉપરોક્ત બાબતે કોઈપણ પ્રશ્નો માટે, તમને કંપનીના RTA, કેફેન ટેકનોલોજીસ પ્રિવેટ લિમિટેડ ની સંપર્ક સેલેનિયમ યાવર બી, પ્લોટ નં.૩૭ અને ૩૮, ડાંગલમસ્ટાલ ઈસ્ટેટ, નાનકરાપાડા, સેરીઝિગમપલી મેડન, હેરાનામ - ૫૦૦૦૩૨, ટેલિફોન: ૦૨૬-૦૬૫૨૬૨૬૨, ઈ-મેઇલ: [suresh.d@kfnitech.com](mailto:suresh.d@kfnitech.com) પર કરવા વિનંતી છે.

શેરધારકો કંપની સેકેટરી અને કંપનીના નોડ ઓફિસર સેકેટરી પૂર્ણ થયે તો પણ સંપર્ક કોર્પોરેટ ઓફિસના સરનામા પીએસપી હાઉસ, સેલેસ્ટા રોડેડાઈની સામે, વિકનગર કોલોનીની સામેની ગલી, ઉડ્ડોન-ગાંધીની રોડ, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૧૮, ટેલિફોન: +૯૧ ૦૭૯૨૬૨૨૦૦/ ૯૫૧૨૦૪૬૪૬૪, ઈ-મેઇલ : [grievance@pspprojects.com](mailto:grievance@pspprojects.com) પર કરી શકે છે.

રચના: અમદાવાદ

તારીખ: આગસ્ટ ૦૧, ૨૦૨૫

**પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ**  
**સહી**  
**પૂર્ણ થયે**  
**કંપની સેકેટરી અને નોડલ ઓફિસર**  
**સંભાષણ નંબર: A48396**

	<p align="center"><b>ntc industries limited</b>  <b>CIN : L70109WB1991PLC053562</b>  Regd.Office: 149, B.T. Road, Kamarhatti,  Kolkata-700 508, Ph: +91 7959046813,  e-mail id: investors@ntcind.com, Website: www.ntcind.com</p>
	<p align="center"><b>INFORMATION REGARDING ANNUAL GENERAL MEETING</b></p>
	<p><b>Members are hereby informed that the 34th Annual General Meeting ('AGM') of the Company will be held on <b>Saturday, 30th August, 2025 at 12:30 P.M. (IST)</b> through video conferencing (VC)/Other Audio Visual means ('OAVM') to transact the businesses as set out in the Notice of the AGM which will be emailed to the Members separately. The venue of the Meeting shall be deemed to be the Registered Office of the Company i.e., at 149, B.T. Road, Kamarhatti, Kolkata-700 508.</b></p> <p>In Compliance with the applicable provisions of the Companies Act, 2013 (the 'Act') and the Rules framed thereunder read with General Circular Nos./14/2020, 17/2020, 20/2020, 02/2021, 21/2021, 02/2022, 10/2022, 09/2023 dated 8th April 2020, 13th April 2020, 5th May 2020, 13th January, 2021, 14th December, 2021, 5th May, 2022, 28th December, 2022 and 25th September, 2023 respectively issued by the Ministry of Corporate Affairs and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIRP/2020/79, SEBI/HO/CFD/CMD1/CIRP/2021/11, SEBI/HO/CFD/CMD1/CIRP/2022/62, SEBI/HO/CFD/POD-2/CIRP/2023/4, SEBI/HO/CFD/CFD-POD-2/CIRP/2023/167 dated 12th May, 2020, 15th January, 2021, 13th May, 2022, 5th January, 2023 and 7th October, 2023 respectively issued by the Securities and Exchange Board of India, the Company is convening its AGM through VC/OAVM/without the physical presence of the Members at a common venue to transact the businesses as set out in the Notice calling the AGM. Members will be able to attend the AGM through VC/OAVM or view the live web cast at <a href="http://www.evoting.nsdl.com">www.evoting.nsdl.com</a> using their login credentials and their presence through the VC facility shall be reckoned for the purpose of quorum under sections 103 and 173 of the Companies Act, 2013.</p> <p>Further, in compliance with the above, the Notice of the 34th AGM along with the Annual Report for the year ended 31st March, 2025 will be sent only by electronic mode to those members whose email address is registered with Depository Participant(s) / Registrar &amp; Share Transfer Agent ('RTA') / the Company. Members may note that the Notice of the AGM and Annual Report for the year ended 31st March, 2025 will also be available on the Company's website <a href="http://www.ntcind.com">www.ntcind.com</a> and on the website of the Stock Exchanges, where the equity shares of the Company are listed, i.e., BSE <a href="https://www.bseindia.com/">https://www.bseindia.com/</a> and of CSE at <a href="http://www.secdia.com">www.secdia.com</a>.</p> <p>Members are requested to attend and participate in the AGM through VC/OAVM only. The instructions for attending the AGM through VC/OAVM are provided in the Notice of the AGM.</p> <p><b>Manner of casting vote through E-voting :</b>  The Company will be providing remote e-voting facility to all its Shareholders to cast their votes on the businesses as set forth in the Notice of the AGM and the facility to vote through e-voting would also be made available during the AGM. The login credentials for casting votes through remote e-voting and e-voting during the AGM shall be made available to the Shareholders through email.</p> <p>The Company has availed the services of National Securities Depository Limited to facilitate e-voting and conduct the AGM through VC. The detailed procedure of casting votes through remote e-voting/e-voting during the AGM for the members holding shares in physical mode, dematerialised mode and for members who have not registered their email address is provided in the Notice of the AGM.</p> <p>All documents referred to in the Notice and the Explanatory Statement shall be made available electronically for inspection by the Members of the Company, without payment of fees upto and including the date of AGM.</p> <p>Members seeking to inspect such documents can send email to <a href="mailto:investors@ntcind.com">investors@ntcind.com</a> mentioning their name, folio no./DP ID and Client ID along with the e-mail address of their PAN card.</p> <p><b>Member of registering / updating email addresses :</b>  Members holding shares in physical form who have not registered their email addresses with the Company / Depository Participant(s) / RTA can obtain Notice of the Postal Ballot and/or login details for the Postal Ballot, by sending scanned copy of the following documents by email to <a href="mailto:investors@ntcind.com">investors@ntcind.com</a> or <a href="mailto:nichetechnl@nichetechnl.com">nichetechnl@nichetechnl.com</a> :</p> <ol style="list-style-type: none"> <li>a signed request letter mentioning your name, folio number and complete address;</li> <li>self-attested scanned copy of the PAN Card; and</li> <li>self-attested scanned copy of any document (such as Aadhaar Card, Driving License, Election Identity Card, Passport) in support of the address of the Member as registered with the Company.</li> </ol> <p>Members holding shares in dematerialised mode, who have not registered/updated their email addresses with the Depository Participants are requested to register/update their email addresses with the Depository Participants with whom they maintain their demat accounts.</p> <p>In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of <a href="http://www.evoting.nsdl.com">www.evoting.nsdl.com</a> or call on toll free no.: 1800 1020 300 and 1800 424 30 or 022 4886 7000 send a request to Ms. Pallavi Mhatre, Senior Manager at <a href="mailto:evoting@nsdl.com">evoting@nsdl.com</a>.</p> <p>The Board has not recommended any dividend for the year ended 31st March, 2025 for approval by the Members at the AGM. However, Members are requested to update their bank details in any case, so that the information can be used for future dividend payment as and when declared.</p>